

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સનું નામ બદલીને ભૂતપૂર્વ મેયર સુઝાન ફેનેલ (Susan Fennell) પર રાખ્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 14, 2021) – આજે યોજાયેલા સમારોહ દરમિયાન, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને વૉડર્સ 3 અને 4 ના પ્રાદેશિક અને સીટી કાઉન્સિલર્સ, માર્ટિન મેડેરોસ (Martin Medeiros) અને જેફ બોમેન (Jeff Bowman) દ્વારા ભૂતપૂર્વ મેયર સુઝાન ફેનેલ (Susan Fennell) ના સન્માનમાં સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સનું નામ બદલવામાં આવ્યું.

આ સ્પોર્ટ્સપ્લેક્સ મૂળભૂત રીતે સપ્ટેમ્બર 28, 1997 નાં રોજ ખોલવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રજીસ્ટર્ડ અને ટ્રોપ-ઇન સ્વીમિંગ, સ્કેટિંગ, રમતો અને ફિટનેસ કાર્યક્રમો, તેમજ રજીસ્ટર્ડ ડાન્સ, STEM (સ્ટેમ) અને બાળકો તેમજ જુવાનિયાઓ માટેના કાર્યક્રમો થાય છે.

બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સુઝાન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સ નામ બદલવાની મંજૂરી સપ્ટેમ્બર 30, 2020 નાં રોજ આપી હતી. આ પ્રસ્તાવ પ્રાદેશિક કાઉન્સિલર માર્ટિન મેડેરોસ (Martin Medeiros) અને અન્ય પ્રાદેશિક કાઉન્સિલર્સ માઇકલ પાલેશી (Michael Palleschi), પૉલ વિસેન્ટે (Paul Vicente), પેટ ફોર્ટિની (Pat Fortini) અને રોવિના સાન્ટોસ (Rowena Santos) દ્વારા મૂકવામાં આવ્યો હતો.

સુઝાન ફેનેલ (Susan Fennell) વિશે

સુઝાન ફેનેલે વર્ષ 1988 થી 2014 સુધી બ્રેમ્પટન સીટી કાઉન્સિલને સેવા આપી હતી. આ સમય દરમિયાન, તેણી સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સને જીવંત બનાવવામાં નિમિત્ત બની હતી, અને તેણીની આગેવાનીમાં શહેરના કેટલાક સૌથી પ્રખ્યાત પ્રોજેક્ટ્સ પૂરા થયા હતા, જેમાં ધી રોઝ થિયેટર, ફ્લાવર સીટી કમ્યુનિટી કેમ્પસ એન્ડ સીનિયર્સ સેન્ટર, કાસી કમ્પબેલ કમ્યુનિટી સેન્ટર, બ્રેમ્પટન સોકર સેન્ટર, ગોર મીડોસ કમ્યુનિટી સેન્ટર, અને સેન્યુરી ગાર્ડન્સ રિક્રિએશન સેન્ટર અને ચિંગકુસી પાર્કનું નવીનીકરણ અને આધુનિકીકરણ સામેલ હતું.

તેણીએ સીટી ઓફ બ્રેમ્પટનના એ પ્રયત્નમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી જેમાં બ્રેમ્પટનના જુમ બસ રેપિડ ટ્રાન્ઝિટ કાર્યક્રમને હકીકતમાં તબદીલ કરવા \$200 મિલિયન જેટલું ફંડરલ અને પ્રોવિન્સિયલ ભંડોળ મેળવી શકાયું હતું, અને તેણીએ વડીલો અને પ્રૌઢ લોકો માટે ડિસ્કાઉન્ટવાળા ભાડા માટે સફળતાપૂર્વક વકીલાત કરી હતી. તેણીએ બ્રેમ્પટનને કેનેડામાં સૌથી ગતિશીલ બહુવિધ-આસ્થા ધરાવતા સમુદાયો પૈકી એક તરીકે વિકસાવવામાં મદદરૂપ થઈને, પ્રાર્થના સ્થળો માટે પોતાના પ્રકારનું પ્રથમ માળખાગત આયોજન વિકસાવવામાં પણ આગેવાની કરી હતી. ફેનેલ ઓલ્ડરલી, ધી કેનેથ ચિશોમ મેન્શનને નિકંદનમાંથી બચાવવામાં અંગત ભૂમિકા ભજવીને, હેરિટેજ (વારસો) સંરક્ષણમાં પણ વિજેતા બની હતી. તેણીના વહીવટી સમયગાળા દરમિયાન, અગાઉના 25 વર્ષ કરતા ઘણી હેરિટેજ ઇમારતો નિર્ધારિત થઈ હતી.

500 રે લોસન બુલેવર્ડ સ્થિત સુઝાન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સ નવી અને બધી હયાત સગવડો રિટ્રોફિટ (ઉમેરણ) કરવાની યોજનાના ભાગ તરીકે સીટી ઓફ બ્રેમ્પટનની પહેલી ઝીરો-કાર્બન ઇમારત બનશે.

સુઝાન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સ રિટ્રોફિટ વિશે

વર્ષ 2019 માં, સીટી ઓફ બ્રેમ્પટને પોતાનો એનર્જી એન્ડ એમિશન મેનેજમેન્ટ પ્લાન 2019-2024: ઝીરો-કાર્બન પરિવર્તન પ્રકાશિત કર્યો. આ યોજના હેઠળ, શહેરે પ્રોવિન્સિયલ અને ફંડરલ ગ્રીન હાઉસ ગેસ (GHG) ઉત્સર્જન 2030 સુધીમાં 30 ટકા અને 2050 સુધીમાં 80 ટકા જેટલું ઘટાડવાના લક્ષ્યાંકો સ્વીકાર્યા છે.

બ્રેમ્પટનની મોટા ભાગની રિક્રિએશનલ સગવડોનો શહેરના વાર્ષિક GHG ઉત્સર્જનોમાં લગભગ 50 ટકા જેટલો ભાગ રહે છે. સુઝાન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સની રિટ્રોફિટ માટે પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ સગવડ ઊંચું GHG ઉત્સર્જન છોડે છે. આ સગવડમાં મોટા ભાગના મોટા સાધનો પોતાના અપેક્ષિત ઉપયોગી જીવનના અંત સુધી પણ પહોંચ્યા હતા. વર્ષ 2019 નાં યુટિલિટી રેટાનો ઉપયોગ કરતા, એ નિર્ધારિત થયું હતું કે આ સગવડ વાર્ષિક ધોરણે લગભગ 1,100 ટન CO₂ ઉત્સર્જન કરતું હતું, જે 238 ઉતારું વાહનોથી નિર્મિત થતા ઉત્સર્જન બરાબર થાય છે.

આ સગવડ પર ફીઝીબિલિટી સ્ટડી (સાધ્યતા અભ્યાસ) સપ્ટેમ્બર 2020 માં કરવામાં આવ્યો હતો, જેમાં ઝીરો-કાર્બન પરિવર્તન માટે જરૂરી ફેરફારો સમાવવામાં આવ્યા હતા. ત્રણ-તબક્કાના પ્રોજેક્ટનો પહેલો તબક્કો સીટી કાઉન્સિલે એપ્રિલ 2021 માં મંજૂર કર્યો અને દરખાસ્તો માટેની માગણી ઓગસ્ટ 2021 માં પ્રકાશિત થઈ હતી.

અવતરણો (ક્વોટ્સ):

“ભૂતપૂર્વ મેયર સુઝાન ફેનેલ (Susan Fennell) અને, બ્રેમ્પટનને સૌ માટે રહેવા, કામ કરવા અને રમતો રમવાલાયક બહુ સરસ સ્થળ બનાવવામાં તેણીની સમર્પણ ભાવનાને ઓળખ આપવામાં હું ગૌરવ અનુભવું છું. બ્રેમ્પટન સીટી કાઉન્સિલમાં પોતાની 26 વર્ષોની સેવા દરમિયાન, તેણીએ સ્પોર્ટ્સપ્લેક્સને જીવંત રૂપ આપવાની સાથે સાથે, આજે આપણાં સમુદાય માટે અને આવનારી પેઢી માટે મહત્વપૂર્ણ ઘણાં પ્રતિમા સમાન (આઈકોનિક) પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“ભૂતપૂર્વ મેયર સુઝાન ફેનેલે પોતાના સમયમાં સીટી કાઉન્સિલમાં ઘણાં કાર્યો પૂરા કર્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન, બ્રેમ્પટન ઝાણ-મુક્ત બન્યું અને બ્રેમ્પટનને ટ્રિપલ AAA ક્રેડિટ રેટિંગ સોંપવામાં આવ્યું હતું. તેણીએ એક સાચો વારસો છોડ્યો છે અને આપણાં શહેરમાં તફાવત ઊભો કર્યો છે, અને અમે આ સગવડનું નામ બદલીને તેણીના ફાળાને સન્માન આપવામાં રોમાંચ અનુભવીએ છીએ.”

- માર્ટિન મેડીરોસ (Martin Medeiros), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4, સીટી ઓફ બ્રેમ્પટન

“સુઝાન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સનું નામ બદલવા ઉપરાંત, આ સગવડ નવી અને હયાત સગવડોને રિટ્રોફિટ કરવાની અમારી યોજનાના ભાગરૂપે સીટી ઓફ બ્રેમ્પટનમાં પહેલી ઝીરો-કાર્બન ઈમારત બનનારી એકમાત્ર સગવડ છે. ભૂતપૂર્વ મેયર ફેનેલે મહિલાઓની હોકીને આ શહેરમાં લાવવામાં અને બ્રેમ્પટનમાં રમતનો ફેલાવો અને સતત વિકાસ કરવા અનિવાર્ય ભૂમિકા પણ ભજવી હતી.”

- જેફ બોમેન (Jeff Bowman), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4, સીટી ઓફ બ્રેમ્પટન

“હું આ ઓળખથી બહુ સન્માનિત અનુભવું છું. સુઝાન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સ પહેલી વાર પૂરું થયું ત્યારથી મારા માટે નોંધપાત્ર છે, વોર્ડના નવા કમ્યુનિટી સેન્ટરમાં મેં ઉપનગરપતિ (એલડરમેન) અને પ્રાદેશિક કાઉન્સિલર તરીકે પ્રતિનિધિત્વ કર્યું, અને મેં સરળ, એક રિંક અને કમ્યુનિટી રૂમવાળી “કૂકી કટર” સગવડમાંથી અસલ ડિઝાઇન વિસ્તારીને કમ્યુનિટી પૂલ, જીમ અને લાઈબ્રેરીવાળી 4-રિંકની સગવડ માટે સફળતાપૂર્વક હિમાયત કરી હતી. હું આ સન્માન માટે મેયર અને કાઉન્સિલની આભારી છું.”

- સુઝાન ફેનેલ (Susan Fennell), ભૂતપૂર્વ મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટનમાં નોંધપાત્ર ફાળો આપનાર વ્યક્તિઓને અમે ઓળખ આપીએ તે મહત્વપૂર્ણ છે. અમે આ મુખ્ય સેન્ટરનું ઔપચારિક નામ બદલીને સુઝાન ફેનેલ સ્પોર્ટ્સપ્લેક્સ કરવામાં રાજી છીએ. સાઈનેજ અદ્યતન કરવાનું કામ ચાલી રહ્યું છે અને અમે અંતિમ પરિણામ માટે આશાવાદી છીએ.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

क्रोओडिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडान्मक संवाढ

सीटी ओफ् ब्रम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca